



ANUPAM RASAYAN INDIA LTD.

Date: September 8, 2021

ARILSLDSTX20210908039

To, BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai -400001, India SCRIP CODE: 543275	To, Sr. General Manager National Stock Exchange of India Limited 'Exchange Plaza', C-1, Block-G, Bandra Kurla Complex Bandra (East), Mumbai 400051, India SYMBOL: ANURAS
---	---

Dear Sir/Madam,

Subject: Newspaper Advertisement-Information regarding 18th Annual General Meeting of the Members of the Company, e-voting and other related information

Pursuant to the Regulation 47 read with Regulation 30 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published today i.e. September 8, 2021 in Financial Express (English) and Dhabkar (Gujarati) which include the following information:

1. Intimation of 18th Annual General Meeting of the Members of Anupam Rasayan India Limited (the "Company") scheduled to be held on Thursday, September 30, 2021 at 4:30 p.m. IST through Video Conferencing ("VC") facility /Other Audio Visual Means ("OAVM") and confirmation of dispatch of Annual Report for the financial year 2020-21, along with Notice of the AGM.
2. Particulars of the facility of e-voting provided to the Members of the Company, to enable them to cast their votes on the resolutions proposed to be passed at the AGM.

Copies of enclosed newspaper advertisement is also uploaded on the Company's website www.anupamrasayan.com.

We request you to kindly note the same and take into your records.

Thanking you,

Yours Faithfully,

For, Anupam Rasayan India Limited


Suchi Agarwal
Company Secretary & Compliance Officer
M.N.: A32822

Registered Office :
8110, GIDC Industrial Estate,
Sachin, SURAT-394 230
Gujarat, India.

Tel. : +91-261-2398991-95
Fax : +91-261-2398996
E-mail : office@anupamrasayan.com
Website : www.anupamrasayan.com
CIN - L24231GJ2003PLC042988

JATALIA GLOBAL VENTURES LIMITED
CIN:L74110DL1987PLC350280
Regd Off: 500, 5th Floor, ITL Twin Tower, Netaji Subhash Place, Pitampura, Delhi 110034
Email: info@jatalia.in

AGM: NOTICE is hereby given that the 34th Annual General Meeting (AGM) of the members of JATALIA GLOBAL VENTURES LIMITED will be held on Thursday, 30th September, 2021 at 3:00 P.M. (IST) at 367, Kohat Enclave, Pitampura, and Delhi-110034, to transact the business as set out in the Notice of the AGM. The Company has sent the Notice of the 34th AGM along with the Annual Report 2020-21 through electronic mode only to those Members whose e-mail addresses are registered with the Company or Registrar & Transfer Agent and Depositories. The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with vide MCA Circulars and the SEBI Circular. The Annual Report 2020-21 of the Company, inter alia, containing the Notice and the Explanatory Statement of the 34th AGM is available on the website of the Stock Exchanges viz. www.bseindia.in. A copy of the same is also available on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

ANUPAM RASAYAN INDIA LTD.
CIN : L24231GJ2003PLC042988
Regd. Office: 8110, GIDC Industrial Estate, Sachin, Surat-394230, Gujarat, India. Tel. No.: +91 - 261 - 2398991 - 95; Fax: +91 - 261 - 2398996
Email: investors@anupamrasayan.com, Website: www.anupamrasayan.com

NOTICE OF EIGHTEENTH 18th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION, RECORD DATE, BOOK CLOSURE, PAYMENT OF DIVIDEND

Notice is hereby given that on account of the ongoing Covid-19 pandemic situation, the Eighteenth (18th) Annual General Meeting (AGM) of the Members of Anupam Rasayan India Limited (the "Company") will be held on Thursday, September 30, 2021, at 4:30 p.m. (IST) through Video Conferencing ("VC") facility / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of AGM. The Company has sent the Notice of AGM along with the Integrated Annual Report for the financial year 2020-21 on September 7, 2021, only through electronic mode to the Members whose e-mail addresses are registered with the Company/Depositories in accordance with the Circular No. 02/2021 dated January 13, 2021, read together with Circular No. 14/2020 dated April 8, 2020, Circular No.17/2020 dated April 13, 2020 and Circular No. 20/2020 dated May 5, 2020, respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA") (collectively referred as "MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, issued by the Securities and Exchange Board of India ("SEBI") (collectively referred as "Circulars"). The Notice of the AGM and Annual Report 2020-21 are also available on the Company's website at www.anupamrasayan.com and on the Stock Exchanges websites BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com and Notice of AGM is available on the website of National Securities Depository Limited (NSDL) at http://www.evoting.nsdl.com

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, each as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India, each as amended from time to time, and above mentioned Circulars, Members are provided with the facility to cast their votes on all the resolutions set forth in the Notice of the 18th AGM using electronic voting system (e-voting) provided by the National Securities Depository Limited ("NSDL"). The voting rights of the Members shall be in proportion to their shares of the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. Thursday, September 23, 2021.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its Members to cast their votes on all the resolutions which are set out in the Notice of the 18th AGM. Members have the option to cast their vote on any of the resolutions using remote e-voting facility or e-voting during the AGM. Detailed procedure for remote e-voting/e-voting during the AGM is provided in the Notice of the AGM. The remote e-voting period commences on Monday, September 27, 2021 (9:00 a.m. IST) and ends on Wednesday, September 29, 2021 (5:00 p.m. IST). The remote e-voting module shall be disabled by NSDL thereafter. The Members who have cast their votes by remote e-voting on the resolutions prior to the AGM may attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes on such resolutions again.

Any person who acquires the shares of the Company and becomes a Member after the Notice is sent and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a Member is already registered with NSDL for remote e-voting, then such Member can use their existing user ID and password for casting the vote. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently.

Members holding shares in electronic mode and who acquire shares of the Company and becomes a Member of the Company after the Notice is sent and holding shares as of the cut-off date may follow steps mentioned in Notice of the AGM.

The Board of Directors of the Company have appointed Mr Mohan Baid, Practicing Company Secretary (Membership No. A3598 COP: 3873) as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting at AGM process in a fair and transparent manner.

In case of any queries, Members may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com. Shareholders/Members, who need assistance before or during the AGM, can contact NSDL official Ms Sarita Mote on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request at evoting@nsdl.co.in.

Helpdesk for Individual shareholders holding securities in demat mode for any technical issues related to login through Depository i.e. NSDL and CDSL.

Table with 2 columns: Login type, Helpdesk details. Rows include Individual Shareholders holding securities in demat mode with NSDL, Individual Shareholders holding securities in demat mode with CDSL.

Payment of Dividend and Tax Deducted at Source (TDS):

1. The Board of Directors at their meeting held on June 12, 2021, has recommended the Dividend of ₹ 0.50/- @ 5% per equity share of the face value of ₹ 10/- for the FY 2020-21, subject to the approval of the Members' at the ensuing AGM of the Company. If the final dividend, as recommended by the Board of Directors, is approved at the AGM, payment of such dividend, subject to deduction of tax at source, will be made on or after October 5, 2021, to all the Beneficial Owners in respect of shares held in dematerialized form as per the data as may be made available by the National Securities Depository Limited ("NSDL") and the Central Depository Services (India) Limited ("CDSL"), collectively referred as "Depositories", as of the close of business hours on Thursday, September 16, 2021. In accordance with the provisions of Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, September 17, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive).

2. Members may note that the Income Tax Act, 1961, ("IT Act") as amended by the Finance Act, 2020, mandates that dividends paid or distributed by a company shall be taxable in the hands of its members. The Company shall therefore be required to deduct tax at source ("TDS") at the time of making the payment of dividend to the Members. For details on taxation, please refer AGM notice.

For Anupam Rasayan India Limited Sd/- Suchi Agarwal Company Secretary and Compliance Officer Date: September 7, 2021 Place: Surat

TOTAL TRANSPORT Keeping Promises Since 1994
TOTAL TRANSPORT SYSTEMS LIMITED
Corporate Identification Number: L63090MH1995PLC091063
Registered Office: 7th floor, T Square, Opp. Chandivali Petrol Pump, Saki Naka, Andheri (E), Mumbai 400 072, Maharashtra, INDIA.
Tel: +91-22-66441500 | Fax: +91-22-66441585 | Email: info@tstpl.in | Website: www.tstpl.in

NOTICE OF 26th AGM, E-VOTING AND BOOK CLOSURE

Notice is hereby given that the 26th Annual General Meeting (AGM) of the Company is scheduled to be held on Thursday 30th September 2021 at 12.30 p.m. (IST) through video conference (VC)/ Other Audio-Visual Means (OAVM) to transact the business that set forth in the Notice of AGM dated 7th September, 2021.

In view of COVID-19 pandemic the AGM will be held through VC/OAVM in compliance with General Circular numbers 20/2020, 14/2020, 17/2020 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI) (collectively referred as "circulars") to transact the business that will be set forth in the Notice of the AGM. Members will be provided with a facility to attend the AGM through electronic platform provided by the Central Depository Services (India) Limited ("CDSL")

- In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies as amended from time to time members are provided with the facility to cast their vote on resolutions set forth in the Notice of AGM using electronic voting means (e-voting) provided by CDSL the voting rights of members shall be in proportion in their holding of shares in paid-up equity share capital of the company as Thursday 23rd September, 2021 ("cut-off date");
i. The remote e-voting shall commence on Monday 27th September, 2021 at 9.00 a.m. (IST)
ii. The remote e-voting shall end on Wednesday 29th September, 2021 at 5.00p.m. (IST)
iii. The cut of date for determining the eligibility to vote by electronic means of the AGM is Thursday 23rd September, 2021
iv. The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, 24th September, 2021 to Thursday, 30th September, 2021 ("Book Closure date") for the purpose of this AGM
v. Those members who shall be present in the AGM through VC/OAVM facility and has not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM.

In compliance with the above circulars the Annual Reports together with the Notice of this meeting have been sent through registered email id to all those members who have registered their email ids with the Company or the Registrar and Transfer Agent or the Depositories or the Depository Participants as on Friday, 3rd September, 2021. If you have not registered the email address with the Company/Depository participants, you may please follow the instructions for registering your email address;

- a. please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate from front and back, PAN (Self - Attested scanned copy of PAN card), AADHAR (self - attested scanned copy of Aadhar Card) by email to RTA. Email id: info@bigshareonline.com.
b. For Demat shareholders -, please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to Company/RTA email id i.e. info@bigshareonline.com.
c. The RTA shall co-ordinate with CDSL and provide the login credentials to the above mentioned shareholders

Members may note that the Notice calling the AGM and the Annual Report for the FY 2020-21 has been uploaded on the website of the Company at www.tstpl.in The Notice and the Annual Report for the FY 2020-21 can also be accessed from the websites of the Stock Exchange i.e. National Stock Exchange at www.nseindia.com. The AGM Notice is also disseminated on the website of CDSL (agency for providing the Remote e-Voting facility and e-voting system during the AGM) i.e. www.evotingindia.com.

This notice is being issued for the information and benefit of all the shareholders of the Company in compliance with the applicable circulars of the MCA and SEBI.

By Order of the Board of Directors For Total Transport Systems Limited Sd/- Bhavik Trivedi Company Secretary & Compliance Officer

Place: Mumbai Date: 7th September, 2021

JAGATJIT INDUSTRIES LIMITED
Corporate Identity Number: L15520PB1944PLC001970
Registered Office : Jagatjit Nagar - 144 802, Distt. Kapurthala (Punjab)
Telephone: (0181) 2783112-14; Email: jil@jagatjit.com
Website: www.jagatjit.com

NOTICE OF THE 76th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 76th Annual General Meeting (AGM) of the Members of Jagatjit Industries Limited will be held on Thursday, 30th September, 2021 at 10.30 A.M. through Video Conference ("VC")/ other Audio Visual Means ("OAVM") in compliance with Ministry of Corporate Affairs (MCA) Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 20/2020 dated 5th May, 2020, Circular No. 02/2021 dated 13th January, 2021 and Securities and Exchange Board of India ("SEBI") Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021. The Company has on 7th September, 2021 completed the dispatch of Notice of AGM and Annual Report for the financial year 2020-21, through electronic mode to those members whose email addresses are registered with the Company/Depositories ("DP").

Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and Rules made thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015, the Register of Members and the share transfer books of the Company will remain closed from Saturday, 25th September, 2021 to Thursday, 30th September, 2021 (both days inclusive) for the purpose of said AGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their votes on all the resolutions set forth in the Notice of AGM, using electronic voting system (remote e-voting) before the AGM. The remote e-voting period commences at 9.00 a.m. on Monday, 27th September, 2021 and will end at 5.00 p.m. on Wednesday, 29th September, 2021. Members may attend the AGM through Video Conference ("VC")/ other Audio Visual Means ("OAVM") and vote thereat electronically. The Members who have cast their vote by remote e-voting prior to the meeting may attend the AGM but shall not be entitled to cast their vote again. The facility of casting votes by a member using remote e-voting system before AGM as well as attending the AGM through Video Conference ("VC")/ other Audio Visual Means ("OAVM") and voting thereat will be provided by Central Depository Services (India) Limited (CDSL).

Voting rights will be reckoned on the shares registered in the name of the Members as on 24th September, 2021 (cut-off date). A person whose name is recorded in the register of members or beneficial owners as on cut-off date i.e. Friday, 24th September, 2021, only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM.

The Members whose e-mail addresses are not registered with the DPs or the Company, are requested to register their e-mail addresses, for obtaining login credentials, by following the instructions below:

- 1. For members holding shares in physical form are requested to provide necessary details like Folio No., name of the Member with complete address, scanned copy of the share certificate (front & back), self attested copy of PAN Card, self attested copy of any document such as Aadhar Card, Driving License, Election Identity Card, Passport in support of the address of the Member as registered with the Company.
2. For members holding shares in Demat Form are requested to update their e-mail id and mobile number with their respective Depository Participant (DP), which is mandatory while e-voting and joining virtual meetings through VC/OAVM.

Notice of 76th AGM is also available on Company's website www.jagatjit.com, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of the CDSL at www.evotingindia.com.

In case of any query with regard to e-voting or attending the AGM through Video Conference ("VC")/ other Audio Visual Means ("OAVM") and voting their at, please refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com. Any query in relation to voting by electronic means may also be addressed directly to Mr. Roopesh Kumar, Company Secretary, Contact Number: +91-8059400510 and/or Email at roopesh.kumar@jagatjit.com.

For and on behalf of Jagatjit Industries Limited Sd/- Roopesh Kumar Company Secretary Date: 7th September, 2021 Place: New Delhi


ITI Asset Management Limited
Investment Manager for ITI Mutual Fund
Registered Office: Naman Midtown, 'A' Wing 21st Floor, Senapati Bapat Marg, Prabhadevi Mumbai - 400 013
Toll Free No: 1800 266 9603
B : 022 6621 4999 • F: 022 6621 4998
E : mfasst@itiorg.com
W : www.itiimc.com
CIN: U67100MH2008PLC177677

NOTICE CUM ADDENDUM No. 21/2021

NOTICE CUM ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT ('SID') / KEY INFORMATION MEMORANDUM ('KIM') OF THE SCHEMES OF ITI MUTUAL FUND AND STATEMENT OF ADDITIONAL INFORMATION ('SAI') OF ITI MUTUAL FUND

Risk-o-meter of scheme(s) of ITI Mutual Fund

NOTICE is hereby given to all the investors / unit holders that pursuant to SEBI circular no. SEBI/HO/IMD/DF3/CIR/P/2020/197 dated October 05, 2020, the Risk-o-meter of the following scheme of ITI Mutual Fund ("the Fund") shall stand revised as under.



Investors are requested to note that, apart from the change in the Risk-o-meter as stated above, there is no other change in the scheme features including nature, investment objective, asset allocation pattern, terms and conditions of the above mentioned scheme. This Notice cum Addendum shall form an integral part of the SAI, SID and KIM of the Fund, as amended from time to time. All other terms and conditions as mentioned in the SAI, SID & KIM shall remain unchanged.

For ITI Asset Management Limited (Investment Manager for ITI Mutual Fund) Sd/- George Heber Joseph Chief Executive Officer & Chief Investment Officer Place : Mumbai Date : September 07, 2021

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HSBC upgrades Azure Power to 'buy' on lower borrowing cost

FE BUREAU New Delhi, September 7

ANALYSTS AT HSBC have upgraded the rating of Azure Power to 'buy' from 'hold', as the company is expected to gain from lower borrowing cost and favourable exchange rates.

The company has raised green bonds at 3.5%, resulting in a reduction in borrowing cost from 9.1% to 8.5%. HSBC said a 100 basis points (bps) drop in interest impacts internal rate of returns (IRR) by around 300 bps. The company, the first Indian power firm to be listed on the New York Stock Exchange, is also seen to gain from exchange rate reducing from ₹74.6/dollar to ₹73/dollar.

In September 2020, HSBC had downgraded Azure Power to 'hold', mainly because of uncertainties related to the government finding buyers of electricity from the solar projects awarded to the company.

Azure's untied capacity is a part of the 12 GW projects awarded in the maiden auction for the manufacturing-linked solar scheme, through which Adani Green Energy was scheduled to build 8 GW generation capacity and Azure Power to develop 4 GW and supply power at ₹2.92/unit.

As part of the deal, the two companies are also required to build 3 GW of solar manufacturing capacities in the country (Adani 2 GW and Azure 1 GW).

IIM-Nagpur launches campus in Pune

THE INDIAN INSTITUTE of Management (IIM)-Nagpur on Tuesday launched its first satellite campus in Pune. Located at the Central Institute of Road Transport, it will start with an MBA programme for working professionals, followed by a full-fledged business administration programme in emerging areas such as data science.

CP Gurnani, MD & CEO, Tech Mahindra, and chairman, IIM-Nagpur board of governors, said they have decided to set up a campus in Pune as industry participation was expected to be higher here. The first batch in Pune starts with 60 working professionals.

—FE BUREAU/PUNE

DELHI JAL BOARD: GOVT. OF NCT DELHI OFFICE OF THE EXECUTIVE ENGINEER (SDW) VII NSTP CORONATION PILLAR DELHI-110009
"STOP CORONA: Wear Mask, Follow Physical Distancing Maintain Hand Hygiene"
SHORT PRESS NIT NO: T0(2021-22)
Table with 5 columns: S. No, Name of work, Estimated Cost, Cost of work (In Rs.), Date of release of tender in E-Procurement solution, Last date/time for receipt of tender through e-procurement solution

NIT along with all terms & conditions is available on website https://govtprocurement.delhi.gov.in
ISSUED BY P.R.O. (WATER) Advt. No. J.S.V. 371/2021-22

AUTOLINE AUTOLINE INDUSTRIES LIMITED
Reg. Office: Survey Nos. 313, 314, 320 to 323, Nanekarwadi, Chakan, Tal: Khed, Dist. Pune 410501
Tel : +91-2135-635865 / 6 | Fax: +91-2135-635864 / 53 | Website: www.autolineind.com
Email: investorservices@autolineind.com | CIN: L34300PN1996PLC104510

NOTICE

NOTICE is hereby given that the 25th Annual General Meeting ("Meeting") of the members of Autoline Industries Limited ("The Company") will be held on Wednesday, September 29, 2021 at 2:30 p.m. through Video Conferencing ("VC") Other Audio Visual Means ("OAVM") in accordance with General Circular Nos. 02/2021 dated January 13, 2021 read together with 14/2020, 17/2020 and 20/2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 read with Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India (together referred to as "Circulars") to transact the business as set out in the Notice of the Meeting (Notice).

In accordance with the above mentioned Circulars, the Annual Report 2020-21 along with Notice seeking consent of members has been dispatched to the Members on September 7, 2021 through e-mail to all its members who have registered their email IDs with the Depository Participants and/or with the Company or with the Company's Registrar and Share Transfer Agent ("RTA"), Link Intime India Pvt. Ltd. The said Annual Report is also posted on the website of the Company i.e. www.autolineind.com and on the websites of the Stock Exchanges, i.e. BSE Limited & National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with the Rules thereunder, amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the Company is pleased to provide its members the facility to cast their vote on Resolution(s) set forth in the Notice using electronic voting system from a place other than the venue of the Meeting ("remote e-voting"), provided by NSDL and the business may be transacted through such voting. The Company is providing remote e-voting and e-voting during the AGM to all its members and detailed procedure of the same is provided in the Notice.

The Remote e-voting period commences on Sunday, September 26, 2021 (9:00 A.M. IST) and ends on Tuesday, September 28, 2021 (5:00 P.M. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on cut-off date i.e. Wednesday, September 22, 2021, may cast their vote electronically. The Remote e-voting module shall be disabled by NSDL for voting thereafter and Members will not be allowed to vote through Remote e-voting electronically beyond the said date and time. Once the vote on a Resolution is cast by a member, he will not be allowed to change it subsequently or cast vote again. Any person who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice and holds shares as on the cut-off date, may obtain login id and password as per the instructions for e-voting mentioned in the Notice of the Meeting. In case such member has not updated his / her PAN Number with the Company / RTA / Depository Participant, may obtain Sequence Number by sending a request at pune@linkintime.co.in.

Members attending the Meeting through VC / OAVM facility and have not already cast their vote by remote e-voting shall be entitled to exercise their vote at the Meeting through e-voting system in the AGM. Members who have cast their vote by remote e-voting prior to the Meeting may also attend the Meeting but shall not be entitled to cast their vote again. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.

The voting right of members shall be in proportion to their shares of the paid up equity share capital of the Company as on cut-off date i.e. Wednesday, September 22, 2021.

The members who have not registered their email addresses with the Company: Those holding shares in physical form: contact the Company along with their name, folio number, scanned copy of their share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to investorservices@autolineind.com.

Members holding shares in Demat form: they can register their e-mail address with their DP only as per the procedure advised by their DP. The registered mail-id will be used for receiving all communication from the Company electronically. The Company has appointed Mr. Sunil Nanal, Partner, KANJ & Co. LLP, Practicing Company Secretaries, Pune to act as scrutiner, to scrutinize the E-voting Process. The result of the voting shall be declared within 48 hours of conclusion of the meeting. In case of any queries in relation to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on Toll Free No.: 1800-222-990 or send a request to Ms. Pallavi Mhatre, Manager, NSDL at the designated email ID: evoting@nsdl.co.in, pallavi@nsdl.co.in or at telephone number +91 22 2499 4545. Members may also write to the Company Secretary of the Company at the registered office address of the Company or e-mail at investorservices@autolineind.com.

By Order of the Board For Autoline Industries Limited Sd/- Ashish Gupta Company Secretary Membership No. A16368 Place : Pune Date : September 8, 2021

ITI MUTUAL FUND Long-term wealth creators
I get the inside information and get inside the information. Inform your opinion with investigative journalism.
The Indian Express. For the Indian Intelligent. The Indian EXPRESS JOURNALISM OF COURAGE

